

# Press Release on the current situation in Afghanistan

August 17, 2021

## અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ અંગે પ્રેસ રિલિઝ

ઓગસ્ટ 17, 2021

કાબુલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આપણા દૂતાવાસના લોકોને તાત્કાલિક ભારત લાવવામાં આવે. આ પ્રક્રિયા બે તબક્કામાં પૂરી થઈ છે અને રાજદૂત તથા તમામ મૂળ ભારતીય લોકો આજે બપોર પછી નવી દિલ્હી પહોંચ્યા છે.

અમે અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં રહેલા તમામ ભારતીયો માટે સમયાંતરે પ્રવાસ અને સુરક્ષાને લગતી સલાહ આપી રહ્યા છીએ. જે લોકો પહેલેથી અફઘાનિસ્તાનમાં છે તેમને તાત્કાલિક પરત આવવા જણાવાયું છે જ્યારે બીજા લોકોને ત્યાં ન જવા સલાહ અપાઈ છે. આમ છતાં અમે જાણીએ છીએ કે ઘણા ભારતીયો તે દેશમાં ફસાયેલા છે. તેમાંથી કેટલાક ત્રીજા દેશના સંગઠનો સાથે કામ કરી રહ્યા છે. અમારી તાત્કાલિક પ્રાથમિકતા હાલમાં અફઘાનિસ્તાનમાં રહેલા તમામ ભારતીય નાગરિકો માટે સચોટ માહિતી મેળવવાની છે. તેમને અને/અથવા તેમના નોકરીદાતાઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ એમઈએના સ્પેશિયલ અફઘાનિસ્તાન સેલને જરૂરી માહિતી આપે. તેના નંબર છે:

ફોન: +91-11-49016783, +91-11-49016784, +91-11-49016785

વોટ્સએપ: +91 80106 11290

Email: SituationRoom@mea.gov.in

અફઘાન નાગરિકોના સંદર્ભમાં અમારી વિઝા સર્વિસ એક ઈ-ઈમરજન્સી વિઝા ફેસિલિટી મારફત ચાલુ રહેશે જે સુવિધા અફઘાન નાગરિકોને પણ આપવામાં આવી રહી છે. તે અમારા ઈ-વિઝા પોર્ટલ

<https://indianvisaonline.gov.in/evisa/Registration> દ્વારા એક્સેસ કરી શકાશે. અમે પહેલેથી અફઘાન શીખ અને હિંદુ સમુદાયના આગેવાનો તરફથી વિનંતી મેળવી છે અને તેમની સાથે સંપર્કમાં છીએ.

કાબુલ એરપોર્ટની કામગીરીની સ્થિતિ એ અફઘાનિસ્તાન જવા-આવવા માટે મુખ્ય પડકાર છે. અમારા પાર્ટનરો સાથે ઉચ્ચ સ્તરે તેની ચર્ચા કરવામાં આવી છે, જેમાં યુએસ વિદેશ મંત્રીના ઈએએમ પણ સામેલ છે. ભારત સરકાર તમામ ભારતીય નાગરિકોની સલામત વાપસી માટે પ્રતિબદ્ધ છે અને કાબુલ એરપોર્ટ પર એક વખત કોમર્શિયલ ઉડાનો શરૂ થાય ત્યાર પછી ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવશે.

નવી દિલ્હી

ઓગસ્ટ 17, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release